

MAXIMAA SYSTEMS LTD.

CIN No. L27100GJ1990PLC014129
240, Naman Plaza, Adj. Rajguru Flyover,
S.V.Road, Kandivali-W, Mumbai- 400067.
Ph: +91 22 28648478 / 28012704
Website: www.maximaagroup.com



Date: 06th September, 2017

To,
The Metropolitan Stock Exchange of India Limited
4th Floor, Vibgyor Towers,
Plot No – C- 62, Opp Trident Hotel,
Bandra Kurla Complex, Bandra (East),
Mumbai – 400 098.

SYMBOL: MAXIMAA

Sub: Publication of Notice of 27th Annual General Meeting, Book Closure and E-Voting Information

Dear Sir/Madam,

With reference to the subject matter, enclosed herewith please find Newspaper Cuttings of the Notice Published for the 27th Annual General Meeting Scheduled to be held on Thursday, 28th September, 2017. Along with Book Closure dates and E-Voting information.

Kindly take the same on record.

Thanking you,

Yours faithfully,

For Maximaa Systems Ltd



Nagraj Mogaveera
Company Secretary and Compliance Officer
Membership No: A49737
Encl: a/a.

Registered Office:

B-1, Yashkamal, Tithal Road, Valsad, Gujarat-396 001, India | Web: www.maximaagroup.com

CHANAKYA

NI POTH

World University Rankings 2018: No Indian institute in top 200

Poor performance in internationalising their campuses and a low research score have pulled down Indian higher education institutes such as the Indian Institute of Science (IISc) and some of the Indian Institutes of Technology (IITs) in the Times Higher Education (THE) World University Rankings 2018.

While IISc has dropped from the 201-250 band in the previous rankings to the 251-300 band, IIT-Delhi and IIT-Kanpur have fallen from the 401-500 band to the 501-600 band. IIT-Madras fell from the 401-500 band to the 601-800 cohort. The drop comes at a time when the IITs have sought more funds under the human resources development ministry's Vishwajeet project aimed at helping them climb in global academic rankings.

THE on Tuesday published the 14th annual edition of its World University Rankings, a list of the top 1,000 universities from 77 countries. According to THE, India's performance has deteriorated, with its number of universities in the top 1,000 declining from 31 to 30.

The University of Oxford retains first place in the World University Rankings. The University of Cambridge climbs two places to second, overtaking the California Institute of Technology and Stanford University, both joint third. While

the US continues to dominate the rankings, Chinese universities are climbing rapidly.

Terming the decline in India's score "disappointing", Phil Baty, editorial director, global rankings, THE, pointed out that other Asian countries such as China and Singapore had been consistently improving their performance.

"As leading universities in other Asian territories such as China, Hong Kong and Singapore are consistently rising up the rankings, in part thanks to high and sustained levels of funding, India's flagship Indian Institute of Science moves further away from the elite top 200," Baty said.

Indian universities performed poorly on internationalisation, with all except one dropping places, mainly due to other universities rising at a faster rate. Government policy limits the number of foreign students who can study in India and prevents international scholars from being hired in long-term faculty positions. THE is of the view that India may recover on this metric on the back of its world-class university plan, which aims to provide additional funding to select public and private universities for infrastructure and academics.

A director of one of the seven older IITs said efforts to improve research through additional

funding had been "slower than desired" from the government as well as the institutes.

Apart from the Vishwajeet project, which will initially fund the seven older IITs, the ministry is identifying 10 public and 10 private institutions as 'Institutes of Eminence'.

The government is also setting up an empowered committee to select 20 institutes with the aim of having them ranked in the top 500 and eventually top 100 global universities.

The government announced in August it would put on hold its plan to allow foreign universities to establish campuses and award degrees in the country but said the 20 universities chosen for the excellence initiative would be free to recruit foreign faculty, admit more foreign students and collaborate with foreign institutions. "There is some really positive news in that India's overall research income and research quality has risen this year, and the country's world-class university plan shows that it recognises the importance of investing in higher education, which may reverse India's decline in the rankings in future years," Baty added.

"There is a need for Indian institutes to market themselves globally," said Shobha Ghosh, assistant secretary-general at the Federation of Indian Chambers of Commerce & Industry

Air India disinvestment: Govt likely to rule out foreign buyer

The government is unlikely to allow foreign bidders to have a majority stake in Air India, which is in the process of privatisation. The group of ministers (GoM) exploring ways to privatise Air India is of the view that Indian ownership is important for the national carrier tag to be retained, sources said.

However, foreign investors will be able to participate in the bidding to own up to a 49 per cent stake in the loss-making carrier in a partnership with an Indian entity, it is learnt.

The international rules on airline ownership and control especially make it difficult for foreign entities to have a majority stake in Air India, a top official said. "International norms mandate a certain ownership rule for airlines which cannot be bent for Air India in isolation. Also, the government wants to keep the national carrier tag status," he said. Not adhering to the rules might make it difficult for Air India to utilise the flying rights it has to operate in foreign countries.

Even as a decision has not been taken yet, the GoM seems to be in favour of vesting majority ownership for Air India in an Indian entity, another source said. The process of disinvestment of Air India is being guided by a GoM, referred to as a committee for an alternative mechanism, headed by Finance Minister Arun Jaitley. The committee has held two rounds of meetings.

secured loan, it should be seen with suspicion.

Prima facie, it implied that these companies were not complying with its mandatory statutory obligations to furnish vital information for its stakeholders, the department said.

An RoC can strike off the name of a company on several grounds: If it fails to commence its business within a year of its incorporation; and for not carrying on its business in two preceding financial years and not making an application to obtain the status of a dormant company.

However, the issue came into the limelight recently after the government promised action against shell companies in the aftermath of demonetisation.

The International Civil Aviation Organisation (ICAO) guidelines on ownership and control have two aspects. The first involves placing limits on foreign nationals' ownership of the voting equity share capital of airlines.

For instance, USA places a limit of 25 per cent on foreign ownership of its airlines; for Japanese airlines the limit is 33 per cent; and the European Union (EU) limits non-EU ownership of the airlines of its member states at 49 per cent. The second element of the restrictions involve the nationality clauses present in the bilateral air services agreements between countries. In essence, the traffic rights granted under these bilaterals require that airlines

benefiting from these rights are substantially owned and effectively controlled by nationals of the state in question.

Although the regulation is not binding and the countries are free to set their own terms, India will have to amend the clause in its agreement with countries adhering to the regulations, the official said. "The government has to discuss and convince all the countries in order to change the norms. It is unlikely that the government will want it," he said. Air India has flying and landing rights across the world.

Among foreign airlines, several including British Airways, Lufthansa and Qantas were privatized, but foreign ownership was not allowed, one of the officials quoted above said.

McDonald's gets NCLT notice, will 169 India outlets face closure today?

The National Company Law Tribunal's (NCLT) principal bench has issued a show-cause notice to fast food chain McDonald's, for not following an earlier order that it should not interfere in the running of outlets given on franchise.

The tribunal's order came as it prima facie found McDonald's guilty of violating a final order issued by it on long drawn matter of dispute between Vikram Bakshi and McDonald's India, following the former's ouster from the post of managing director (MD) of the joint venture (JV) company. The NCLT bench had asked McDonald's not to intervene in operations of Connaught Plaza Restaurants Pvt Ltd (CPRL). However, CPRL turned defunct after McDonald's last month terminated the franchise licensing agreement with it.

The company is expecting that while revenues might go up slowly in the initial years, it will jump substantially later on and could be much more than Rs 800 crore a year, which is required to break even (last year it had advertising revenues of Rs 200 crore). It also expects to expand the base of advertisers to include local companies.

According to a Ficci-KPMG report, digital advertising, which was at Rs 7,600 crore in 2016, constituting 15 per cent of overall advertising revenues, is expected to go up to Rs 29,000 crore in 2021, constituting over 27 per cent of total advertising revenues.

STAR is not looking at any revolutionary changes in its TV strategy from that of its rival Sony. Sony, for instance, made Rs 1200-1300 crore last year on IPL advertisements and another Rs 500 crore through subscription revenues, say industry sources.

What STAR would require is a combined revenue from advertising and subscription of about Rs 2,200 crore each year to recover their costs. That is based on the premise that Sony, which was the highest bidder, had put in a price of over Rs 11,050 for the five year rights.

The dispute that came out in open in September 2013

My focus was always under-promise and over-achieve: Raghuram Rajan

Banks were fooling themselves by not acknowledging their bad debt mess, says former Reserve Bank of India (RBI) governor Raghuram Rajan. Speaking on the sidelines of the release of his book "I do what I do" in Chennai, Rajan says through his speeches he had tried to warn about the impending dangers, which have largely come true now. He also reveals his plan for setting up a liberal arts university in south India as part of his continued engagement with the country. Edited excerpts:

How does an event like demonetisation impact efforts to internationalise the rupee?

I haven't thought about that as much, because most international investors are invested in financial assets. Demonetisation was not really about financial assets.

Do you think something more is left to the demonetisation saga?

Very hard to tell. First, we have a concatenation of factors. We have had the twin balance sheet problem, the anticipation of GST (goods and services tax), and then demonetisation. These three things probably had adversely affected growth. On the positive side, the world economy is doing better. So there should be a positive effect of growth there. Net effect is, whether we have seen the end is hard to say. Certainly, I understand there's enough currency available and nobody would be prevented from doing transactions. The two sources of lingering effects of the adverse side are: one, sentiments are depressed, and two, some small and medium enterprises that were working on thin buffers may have shut shop when they found that sales were plummeting for cash-based transactions. Those could be bringing down the growth potential for a little while, until we see new businesses starting up.

You have a research paper that shows that small firms should grow rapidly for the economy to strengthen. That momentum is hurt, right?

Yes. Any firm that goes out of business, you have to recreate its economic capital, its social capital. All that will take some time. That's why recessions have serious effects because businesses go out. Now some businesses that shut shop may have deservedly had to shut shop because they weren't particularly profitable. But to the extent the lack of liquidity, lack of loans they were experiencing, is a problem.

We are transitioning to a middle income economy. Are we prepared for that?

We are working on our institutions. This recent move to bring in the bankruptcy code is very useful. It is one of the institutions we need for a stronger financial sector. I think if we keep doing that, we have the precondition for take-off. One of the most important institutions that we have, and this should strengthen, is the Competition Commission. I think we need to continuously beef up the capacity of our central bank and our regulatory bodies.

What about the autonomy of the RBI and its governor?

I think we have some autonomy and it's important to preserve it.

But you said the bureaucracy tries to whittle down the powers of the RBI governor.

I think it is not so much (about) the autonomy, it's the turf. Every person likes to build more of an empire. And in an environment where the government feels constrained by the RBI, it may on certain occasions allow the bureaucracy more reign. I think it's important to have a balance. Interestingly, when a job has to be done, because the RBI has built a certain amount of capabilities, that job is often entrusted to the RBI. It's back and forth.

What were the other alternatives to demonetisation that the RBI suggested to the government?

I can't talk about the specifics of the alternatives. But I can say that narrowing the scope for evading black money is something the government has been working on, like mandating Aadhaar for the deposit accounts. That is an important step forward because that would slow down the flow of black money.

After the Supreme Court judgment on privacy, the use of Aadhaar has come into question.

I think it is important for the RBI and the government to satisfy the Supreme Court that privacy issues are being respected by the whole Aadhaar process. I think the Supreme Court has a valid concern that it should not be open for everybody and on any basis whatsoever. It shouldn't be possible for people to fishing for private data, even for government officials to have free access to that private data. So, those kinds of privacy inputs have to be built in and the onus is on the government for those kind of regulatory institutions to prove to the Supreme Court that that has been done.

This time farmer distress was largely because of demonetisation. What's your view on the moral hazard of such farm debt waivers?

I don't want to comment on specific sources of farmer distress because I am not sure where it has come from. I do agree with a number of statements that have been made, which I also made when I was the governor, that loan waivers tend to be problematic for the farmers themselves because

access to credit tends to get weaker over time because bankers fear the weakened credit culture. Also, these loan waivers don't touch the farmers who borrowed from the informal sector such as from moneylenders. These farmers may be in difficulty the most. Those with access to public sector loans may be better off. So we have to be a little careful in these situations. Not to vitiate the credit culture and not to be disproportionate beneficial to the farmers who can stand on their own but not to those who can't. The broader point is that we have to ask what are the sources of agricultural stress and address those at the root.

Should RBI be looking into individual accounts?

I think if you ask the question that way, the answer could be that the RBI should not be both the regulator as well as (someone) making commercial decisions. If you are in a special situation where you have to nudging the process forward, lighter the nudge the better. As I understand, the RBI has so far pushed a number of banks to invoke the bankruptcy code but not specified what kinds of haircut have to be taken. It seem to me that it is a slight nudge. You can argue that even that push should be given by the banks themselves, not the RBI. Fundamentally, the issue has to be how do we make the environment such that banks would take commercial decisions.

Banks don't have capital, while the RBI's provisioning norm is very steep. In just six months, as liquidation begins and banks have to set aside more provisions, some banks may become bankrupt.

MAXIMAA SYSTEMS LIMITED

Regd. Off.: B-1, Yashkamal, Tithal Road, Valsad-396001
CIN : L27100GJ1990PLC014129
Email : cs@maximaasystems.com
Website : www.maximaagroup.com
Ph : 022-42978110/28648478

NOTICE OF 27TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE, AND E-VOTING INFORMATION

Notice is hereby given that the 27th Annual General Meeting (AGM) of the Company will be held on Thursday, 28th September, 2017 at 9.30 am at the registered office of the Company at B-1, Yashkamal, Tithal Road, Valsad-396001, Gujarat.

Pursuant to provisions of section 91 of the Companies Act, 2013 and as required under Regulation 42 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015, the Register of Member and Share Transfer Books will remain closed from 22nd September, 2017 to 28th September, 2017 (both days inclusive) for the purpose of AGM of the Company.

Electronic copies of the Annual Report have been sent to all the members whose email IDs are registered with the Company / Depository Participant(s). The same are also available on the website of the Company at www.maximaagroup.com. Annual Report has been sent to all the other members at their Registered address in the permitted mode.

Pursuant to the provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended, and SEBI (LODR), Regulations, 2015, the Company is providing its members facility to exercise their right to vote on resolutions proposed to be passed in the Annual General Meeting ("Meeting") scheduled to be held on Thursday, 28th September, 2017 at 9.30 a.m. at the registered office of the Company at B-1, Yashkamal, Tithal Road, Valsad-396001. The members may cast their votes using the electronic voting system from a place other than the venue of the Meeting ('remote e-voting'). The Company has engaged the service of Purva Share registry (India) Private Limited as the Agency to provide e-voting facility.

The Communication relating to remote e-voting inter alia containing User ID and password along with the copy of Notice convening the Meeting has been dispatched to the members. This communication and the Notice of the Meeting are available on the website of the Company at www.maximaagroup.com.

The remote e-voting facility shall commence from Monday 25th September, 2017 at 9.00 a.m. and ends on Wednesday, 27th September, 2017 at 5.00 p.m. The remote e-voting shall not be allowed beyond the said date and time.

A person whose name appears in the Register of Members / Beneficiary owners as on the cut-off date i.e. 21st September, 2017, only shall be entitled to avail the facility of remote e-voting as well as voting at the meeting.

Any member who becomes the member of the Company after the dispatch of the Notice of the Meeting and holding shares as on the cut-off date i.e. 21st September, 2017, may obtain the user ID and password by sending a request at purvashr@gmail.com / buscomp@gmail.com. The detailed procedure for obtaining the user ID and the password is also provided in the Notice of the Meeting which is available on the Company's website. If the member is already registered with Purva Share registry (India) Private Limited he can use his existing User ID and password for casting the vote through remote e-voting.

The members who have cast their vote through remote e-voting may attend the meeting but shall not be entitled to cast their vote again.

The facility of voting through poll shall be made available at the meeting and the members attending the meeting who have not cast their vote by remote e-voting shall be able to vote at the meeting through poll.

In case of any query / grievance relating to voting by electronic means, the members / Beneficiary owners may contact at the following address: Purva Share registry (India) Private Limited: Unit no. 9, Shiv Shakti Ind. Estt. J.R. Boricha Marg, Opp. Kasturba Hospital Lane, Lower Parel (E), Mumbai- 400 011. Mr. Rajesh Shah Ph: 022- 2301 0771/8261/2518.

For and on behalf of
Maximaa Systems Limited
Sd/-
Nagraj Mogaveera
(Company Secretary)

Place : Valsad
Date : 06-09-2017

ધી ઝુજલાઈન

વર્ષ : ૨૪ અંક ૦૦૬ તારીખ ૦૬-૦૮-૨૦૧૭ પાનાં : ૪ માલિક : જયની પબ્લીશર્સ તંત્રી : શ્રી રણછોડ એન. શાહ સહ તંત્રી : રાધિકા ગંજવાલા

અર્થતંત્રમાં આવતા ૬ મહિના દરમ્યાન જોરદાર વૃદ્ધિની ગણતરી

ગયા અઠવાડિયે સેન્સેક્સ અને નિકેટી માટે નીચલો સપોર્ટ લેવલ દર્શાવેલો અને સાથે સાથે બજારમાં તીવ્ર વધઘટનો ટ્રેન્ડ રહેશે તેમ પણ સ્પષ્ટ રીતે દર્શાવેલું અને તે મુજબ જ ગયા અઠવાડિયા દરમ્યાન વિવિધ કાર્પોરેટ સેન્સેક્સ અને નિકેટીમાં વધઘટનો ટ્રેન્ડ જળવાયો. આંતરરાષ્ટ્રીય સ્તરે સૌ પ્રથમ અમેરિકન અર્થતંત્રની વાત કરીએ તો અમેરિકામાં હાર્ડિસિંગ સેક્ટરમાં નવા ઘરોના આંકડા ખૂબ જ પ્રોત્સાહક આવ્યા છે અને જુલાઈ મહિના દરમ્યાન નવા ઘરોના આંકડામાં ૮.૪ ટકાની વૃદ્ધિ જોવાઈ અને ૫.૭૧ લાખ નવા ઘરોનું કામકાજ શરૂ થયું છે. તેવી જ રીતે રોજગારીના આંકડાઓ પણ ખૂબ જ પ્રોત્સાહક છે અને બેરોજગારીનું લેવલ સતત ૩ લાખની નીચે જ જળવાઈ રહ્યું છે. તેમ છતાં અમેરિકન પ્રમુખ ટ્રામ્પ દ્વારા અફઘાનિસ્તાન સામે પગલાં લેવામાં આવશે તેવા સ્ટેટમેન્ટને કારણે ગયા

અઠવાડિયા દરમ્યાન ડાઉજોન્સ ઈન્ડેક્સીયલ એવરેજમાં તીવ્ર કરેક્શન જોવાયું હતું અને સાથે સાથે હવે ભારતમાં શેરબજારના ઓંગલથી ખાસ કોઈ નવા ડેવલપમેન્ટ નથી અને ગયા અઠવાડિયે હવે ઉડયન વિભાગને પણ તેમાં લાવી દેવાય તેવી ગણતરી છે. ગયા અઠવાડિયે જીએસટીના પ્રથમ રિટર્ન ભરવાની તારીખ હતી અને તેમાં વિવિધ કંપનીઓ દ્વારા જીએસટીની ચુકવણી કરીને પ્રારંભિક રિટર્ન ભરવામાં આવ્યા છે અને આ કર ચુકવણીને કારણે પ્રારંભિક અંદાજ છે કે જીએસટીને કારણે સરકારની કર વસુલમાં નોંધપાત્ર ઉછાળો આવશે અને કદાચ આ પગલાં પછી એક તરફ સરકારની ખામ ઘટે અને સાથે સાથે બીજી તરફ આગામી દિવસોમાં કરવેરાનું માળખું વધારે સરળ કરવામાં આવે તેવી ગણતરી છે.

આગામી દિવસોમાં કરવેરાનું માળખું વધારે સરળ કરવામાં આવે તેવી ગણતરી છે

અમેરિકન પ્રમુખ ડેશની સરહદ ઉપર ભીંત બાંધવા માટે પણ તત્પર દેખાય છે અને આ ડેવલપમેન્ટને કારણે ગયા અઠવાડિયા દરમ્યાન અમેરિકન શેરબજારોમાં વધઘટનું પ્રમાણ થોડું વધારે તીવ્ર રહ્યું હતું. તીવ્ર કરેક્શન પછી ૨૩મી ઓગસ્ટે ફરી એક વખત ડાઉજોન્સમાં ૨૦૦ પોઈન્ટનો ઉછાળો જોવાયો અને તેવી રીતે એપ્રિલ મહિના પછી આવો પ્રથમ સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો.

ઈન્ફોસિસમાં ઉતાવળ કરીને ખરીદી નહીં કરવાની વાત દર્શાવેલી અને તે મુજબ ઈન્ફોસિસમાં ગયા અઠવાડિયા દરમ્યાન પણ નબળાઈનો ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે. વિશાલ સિક્કાના રાજીનામા પછી અત્યારે કંપનીના સ્થાપક નારાયણ મૂર્તિ ઉપર ચારેબાજુથી પ્રસ્તાવ પડી રહી છે. પરંતુ આ ડેવલપમેન્ટ પછી પણ ઈન્ફોસિસ લોંગટર્મ ઓંગલથી જોઈએ તો મજબૂત કંપની તરીકે જળવાઈ રહેશે. પરંતુ શોર્ટટર્મમાં આ શેર ઉપર દબાણ વધે તેવી ગણતરી છે.

ગયા અઠવાડિયે મહત્વના ડેવલપમેન્ટમાં કેન્ટ્રિય કેબિનેટે વિવિધ જાહેર ક્ષેત્રની બેન્કોના ઝડપી મજૂર માટેનું માળખું મંજૂર કર્યું છે. ગયા મહિના દરમ્યાન એનપીએ વધી ગઈ હોવાને કારણે પબ્લિક સેક્ટર બેન્કોના શેરોના ભાવમાં લગભગ ૮થી ૧૦ ટકાનો ઘટાડો જોવાયો હતો અને તે પછી આ નવા ડેવલપમેન્ટને કારણે જાહેરક્ષેત્રની બેન્કોના શેરોમાં ઉછાળો જોવાયો છે.

આ નવા માળખામાં કોઈ પણ પ્રકાર રોકડની આપલે નહીં થાય. પરંતુ વિવિધ બેન્કોના મજૂરમાં કેવળ શેરોની અદલાબદલી થશે અને તેમાં કોઈ પણ પ્રકારની બેરોજગારી પણ નહીં આવે. પરંતુ કેન્દ્ર સરકારના આ પગલાં સામે ગયા મંગળવારે કર્મચારી યૂનિયનનો હડતાળ ઉપર ગયા હતા.

આ મજૂરની પ્રક્રિયા કોઈ પણ બેન્ક ઉપર થોપી દેવામાં નહીં આવે અને મજૂરનો નિર્ણય જેને બેન્કના ડાયરેક્ટરો દ્વારા જ લેવામાં આવશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી. બેન્કિંગ નિષ્ણાતોનું મતવ્ય છે કે મોટી બેન્કો બેન્ક ઓફ બરોડા અને કેનેરા બેન્ક દ્વારા નાની બેન્કો વિજયા બેન્ક, યુકો બેન્ક, દેના બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા વગેરે હસ્તગત કરવામાં આવશે અને તે રીતે કેન્દ્ર સરકારને તેના દેના બેન્કના શેરની સામે બેન્ક ઓફ બરોડાનો શેર મળી જશે અને કેન્દ્ર સરકારના હોલિંગમાં કોઈ જ ફેરફાર નહીં આવે. પરંતુ નાની બેન્કોને મોનિટર કરવાની મુશ્કેલી ઘટી જતાં રિઝર્વ બેન્ક કામકાજ પણ સરળ બને તેવી ગણતરી છે અને સાથે સાથે બેન્કો વધારે મજબૂત હોય તો તેને કારણે બજારમાંથી પણ તેઓ ભંગોળ મેળવી શકશે અને આ ડેવલપમેન્ટ પછી આગામી દિવસોમાં બેન્ક શેરોના ભાવ સુધરતા જાય તે સંભાવના મજબૂત છે.

બીજી તરફ સેબી દ્વારા પોતાના ઓર્ગેનિઝમમાં મહત્વની પાલી પોર્ટલી જગ્યા અંગે વિવિધ અધિકારીઓની ભૂમિકામાં ફેરફાર કરાયો છે અને આ ફેરફાર દ્વારા પોર્ટલી પોર્ટલી જગ્યાઓની મુશ્કેલીઓ દૂર કરી નાંખવાની ગણતરી છે.

આગામી દિવસોમાં હવે કેન્ટ્રિય કેબિનેટને રિસ્કફ્રી થઈ રહ્યું છે અને જે રીતે છેલ્લાં થોડાં દિવસો દરમ્યાન ભારતીય રેલ્વેમાં અનેક અકસ્માતો થયા તેને કારણે રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુનું રાજીનામું સ્વીકારી લેવાય અને તેમને બીજું કોઈ માતું આપવામાં આવે તે સંભાવના મજબૂત છે. પરંતુ સામે પક્ષે ઉડયન વિભાગ અને રેલ્વેનું મજૂર પણ અપેક્ષિત છે અને ગયા અઠવાડિયે એર ઈન્ડિયાના વડા લોહાની રેલ્વે વોર્ડના ચેરમેન તરીકે નિમવામાં આવ્યા. છેલ્લાં કેટલાંક સમયથી વડાપ્રધાન શ્રી મોદી અસંખ્ય મંત્રાલયોને ભેગા કરીને તેમનું કામ કોન્સોલિડેટ અને સરળ કરવાની વ્યવસ્થા અપનાવી રહ્યા છે અને તે મુજબ માર્ગ અને વાહન વ્યવહાર વિભાગને રેલ્વે સાથે જોડી દેવાયા પછી

કે બોટમલાઈનમાં માંડ પથી ૮ ટકાના દરે વધતી હોય તો તેમનો ઈન્ફેક્શનો પીઈ રેશિયો અત્યારે ૧૭-૧૮ ઉપર હોય તો તે ચોક્કસ ઉંચો જ કહી શકાય અને તેથી વાસ્તવમાં તો સમજૂ એફઆઈઆઈ અમેરિકન શેરબજાર ઉપરનું કોક્ક ઘટાડીને ભારતીય શેરબજારમાં ફિફ્ટ કરે તે સંભાવના વધારે મજબૂત છે.

કેટલાંક એનાલિસ્ટોને પ્રથમ ક્વાર્ટરના કંપનીઓના આંકડા નબળા આવાયા તે પણ ચિંતારૂપ લાગે છે અને એટલે આવા એનાલિસ્ટો શેરબજાર ખૂબ જ ઉંચું છે તેમ દર્શાવી રહ્યા છે. પ્રથમ ક્વાર્ટરના અમુક કંપનીઓના આંકડા નબળા આવાયા. અમુકમાં વેચાણ વૃદ્ધિ નેગેટીવ થઈ અને નફામાં પણ ૭૦-૮૦ ટકાનો ઘટાડો થયો તે વાત સાચી છે. પરંતુ આ બન્યું કેમ તેની પાછળના કારણો જોવા જોઈએ અને જે કારણોને લીધે વેચાણો ઘટ્યા હોય અથવા નફા ઘટ્યા હોય તે કારણો હવે બાકીના ૮ મહિનામાં અસર કરશે કે કેમ તે અંગે આપણે સૌએ વિચારવું પડે.

ચાણક્યના કંપની ન્યૂજના પાનામાં તમે અનેક વખત વાંચ્યું હશે કે જીએસટીની અસરને કારણે અનેક કંપનીઓના વેચાણો ઘટ્યા છે. જીએસટી આવી રહ્યો છે અને તેમાં જૂના સ્ટોકની કેરિટ કેવી રીતે લેવી તે મુશ્કેલ હોવાથી અનેક ઉદ્યોગોમાં વેપારી વર્ગે નવી ખરીદી ઘટાડીને પોતાનો સ્ટોક નીચે લાવી દેવાની વ્યૂહરચના અપનાવેલી. ઓટોમોબાઈલ સેક્ટરની જ વાત કરીએ તો પોતાની પાસેનો માલ વેચી નાંખવા માટે મોટા ભાગના ડીલરોએ જંગી રિસ્કાઉન્ડો આપેલા અને સાથે સાથે ઓટોમોબાઈલ ઉત્પાદકો પાસેની ખરીદી પણ ઘટાડી નાંખી હતી અને સ્વાભાવિક છે કે તેને કારણે ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ વગેરેના વેચાણો ઘટ્યા હોય અને સાથે સાથે નફા પણ ઘટ્યા હોય. પરંતુ જીએસટી પણ અમલમાં આવી ગયો અને જીએસટી અંગે ખાસ કોઈ વિરોધ પણ નથી

શાંત ચિત માટે મગજને સતેજ રાખે તેમજ ચિંતા, અકળામણ, ગુસ્સો દૂર કરે તે માટે વૈજ્ઞાનિક ઢબે તેયાર થયું કોસ્વર્ક મેગેઝીન

મગજમારી **ભેજમારી**

નિવૃત્ત લોકો, ગૃહિણીઓ, બાળકો, ચાલીસીમાં પ્રવેશી સૂકેલાઓ માટે બેસ્ટ

દર બુધવારે, કોમી બુક સ્કવો

અથવા તો જે શેરબજાર વધારે રિટર્ન આપતું હોય તેમાં જ કોઈ પણ સમજૂ રોકાણકાર રોકાણ કરે અને તેથી વિદેશી સંસ્થાઓ ભારતમાંથી પૈસા પાછા ખેંચી લેશે તેવો કોઈ ભય રાખવાની મને જરૂર નથી લાગતી.

૨૬ પ ટકાના ડોલર મૂલ્યાના રિટર્ન પછી પણ ભારતીય ઈન્ફેક્સ એટલે કે સેન્સેક્સ અને નિકેટી છેલ્લા ૧૨ મહિનાની કમાણી સામે ૧૮.૬નો પીઈ રેશિયો દર્શાવે છે અને આ પીઈ રેશિયો મારી દૈનિકે એકદમ યોગ્ય એટલે કે રીઝનેબલ છે. સામે પક્ષે અમેરિકાનો ડાઉજોન્સ ઈન્ડેક્સીયલ એવરેજ છેલ્લા ૧૨ મહિનાની કમાણી સામે અત્યારે ૧૭.૮નો પીઈ રેશિયો દર્શાવે છે.

એક અભ્યાસી તરીકે તમને પ્રશ્ન થશે કે ક્યો પીઈ રેશિયો જે તે શેરબજાર માટે યોગ્ય કહી શકાય ? આ અંગે એક સાદું ગણિત છે કે જે શેરબજારમાં કંપનીઓનો વૃદ્ધિર ઉંચો હોય તેને માટે ઉંચો પીઈ રેશિયો યોગ્ય કહેવાય અને ભારતીય કંપનીઓની ટોપલાઈન અને બોટમલાઈનમાં અત્યારે ખૂબ સુધર વૃદ્ધિ હાંસલ થઈ રહી છે અને તેથી ભારતીય શેરબજાર માટે ૧૮નો પીઈ રેશિયો એકદમ રિઝનેબલ છે અને તે મુજબ માર્ગ અને વાહન વ્યવહાર વિભાગને રેલ્વે સાથે જોડી દેવાયા પછી

કેટલાંક એનાલિસ્ટોને પ્રથમ ક્વાર્ટરના કંપનીઓના આંકડા નબળા આવાયા તે પણ ચિંતારૂપ લાગે છે અને એટલે આવા એનાલિસ્ટો શેરબજાર ખૂબ જ ઉંચું છે તેમ દર્શાવી રહ્યા છે. પ્રથમ ક્વાર્ટરના અમુક કંપનીઓના આંકડા નબળા આવાયા. અમુકમાં વેચાણ વૃદ્ધિ નેગેટીવ થઈ અને નફામાં પણ ૭૦-૮૦ ટકાનો ઘટાડો થયો તે વાત સાચી છે. પરંતુ આ બન્યું કેમ તેની પાછળના કારણો જોવા જોઈએ અને જે કારણોને લીધે વેચાણો ઘટ્યા હોય અથવા નફા ઘટ્યા હોય તે કારણો હવે બાકીના ૮ મહિનામાં અસર કરશે કે કેમ તે અંગે આપણે સૌએ વિચારવું પડે.

ચાણક્યના કંપની ન્યૂજના પાનામાં તમે અનેક વખત વાંચ્યું હશે કે જીએસટીની અસરને કારણે અનેક કંપનીઓના વેચાણો ઘટ્યા છે. જીએસટી આવી રહ્યો છે અને તેમાં જૂના સ્ટોકની કેરિટ કેવી રીતે લેવી તે મુશ્કેલ હોવાથી અનેક ઉદ્યોગોમાં વેપારી વર્ગે નવી ખરીદી ઘટાડીને પોતાનો સ્ટોક નીચે લાવી દેવાની વ્યૂહરચના અપનાવેલી. ઓટોમોબાઈલ સેક્ટરની જ વાત કરીએ તો પોતાની પાસેનો માલ વેચી નાંખવા માટે મોટા ભાગના ડીલરોએ જંગી રિસ્કાઉન્ડો આપેલા અને સાથે સાથે ઓટોમોબાઈલ ઉત્પાદકો પાસેની ખરીદી પણ ઘટાડી નાંખી હતી અને સ્વાભાવિક છે કે તેને કારણે ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ વગેરેના વેચાણો ઘટ્યા હોય અને સાથે સાથે નફા પણ ઘટ્યા હોય. પરંતુ જીએસટી પણ અમલમાં આવી ગયો અને જીએસટી અંગે ખાસ કોઈ વિરોધ પણ નથી

હિંદુસ્તાન યુનિલીવરમાં તો છેલ્લાં ઘણાં સમયથી ક્વર કરતા જવાનું ચાણક્યમાં દર્શાવેલું છે. કેટલાંક શ્રદ્ધાળુઓને ભય છે કે હિંદુસ્તાન યુનિલીવર જ્યારે નવું ટોપ બતાવે ત્યારે શેરબજારમાં મંદી શરૂ થઈ જાય અને પીઈ રેશિયોની દૈનિકે જોઈએ તો હિંદુસ્તાન યુનિલીવરનો અત્યારનો ૩.૧૮૮નો ભાવ પડનો ખૂબ જ ઉંચો પીઈ રેશિયો દર્શાવે છે. પરંતુ ઉપરોક્ત કારણોસર જૂન ક્વાર્ટરના પરિણામો થોડાં નબળા આવાયા અને આગામી સમયગાળામાં પરિણામો સુધર આવશે તે સંભાવના મજબૂત છે અને તે પાછળ આગામી સમયગાળામાં આ શેર ધીરે ધીરે ૩.૧૩૦૦ તરફ આગળ વધે તો સહેજે નવાઈ નહીં લાગે.

ગયા અઠવાડિયે જ્યુબિલન્ટ ફૂડવર્ક્સમાં કરંટની સંભાવના દર્શાવેલી અને તે પછી જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ અત્યારે એક જ અઠવાડિયામાં સુધર ઉછાળા સાથે ૩.૧૩૦૦ ઉપર આવ્યો છે. ભાગ્યશાળીને ભૂત રગે તે કહેવતમાં પણ દમ છે. જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ એ ડેમિનોઝ પિઝાની શ્રૂબલા ધરાવે છે અને તેના મુખ્ય હરિફ તરીકે મેકડોનાલ્ડ કહી શકાય અને આ અમેરિકન જાન્યંત્ર અને તેના ભારત ખાતેના સહયોગી વચ્ચે કેટલીક ભાવનોમાં મતભેદ થયા છે અને તે પાછળ મેકડોનાલ્ડ અમુક આઉટલેટ બંધ કરી દે તેવા સમાચારો આવી ગયા. સ્વાભાવિક છે કે આ ડેવલપમેન્ટનો ફાયદો ડેમિનોઝ પિઝાને મળે અને આ શેરમાં વધારે ભડકો થાય તે સંભાવના છે.

ટાટા ગ્લોબલનો શેર અત્યારે ૩.૧૮૬ આસપાસ ચાલી રહ્યો છે. પીઈ રેશિયોની દૈનિકે શેરનો અત્યારનો બજારભાવ ઘણો ઉંચો કહી શકાય. પરંતુ ગયા વર્ષે ટાટા ગ્રૂપના બે શેરો ટાટા સ્ટીલ અને ટાટા કેમિકલ્સ ચાલી ગયા હતા અને તે પાછળ મેકડોનાલ્ડ સાથે એક વખત ૩.૧૮૬ના ભાવે આ શેરમાં હજી મજબૂત ઉછાળા સાથે એક વખત ૩.૧૩૦૦નો ભાવ આવે તો પણ નવાઈ નહીં લાગે અને તેથી રોકાણ જાળવી રખાય. તેવી જ રીતે ટાટા કોફીનો શેર પણ અત્યારના ભાવે ધ્યાનમાં રખાય. ટાટા ગ્રૂપની કાબેલિયત અનુસાર આ કંપની હવે વિયેતનામમાં પોતાનો પ્લાન્ટ નાંખી રહી છે. વિયેતનામની કોફી વિશ્વભરમાં વખણાય છે અને વિયેતનામમાં કોફી બનાવીને આ કંપની વિશ્વભરમાં નિકાસ કરશે અને એક મોટું નામ કમાશે અને શેર હોલ્ડરોને પણ કમાવાવિશે તે સ્વાભાવિક છે અને તેથી થોડાંક શેર ટાટા કોફીના લઈ



બાબત છે અને તેને કારણે અર્થતંત્રમાં આવતા ૬ મહિના દરમ્યાન જોરદાર વૃદ્ધિની અમારી ગણતરી છે અને તેથી પ્રથમ ક્વાર્ટરના કેટલીક કંપનીઓના આંકડા ભૂલી જઈ અને બિનજરૂરી ચિંતા કરવાને બદલે સારા શેરો ઉપર કોક્ક કરતા રહેવું.

જીએસટીની સૌથી તીવ્ર અસર એફએમસીજી કંપનીઓ ઉપર પડી છે અને મોટા ભાગની કંપનીઓના ડીલરોએ માલ ખરીદવાનું એકદમ ઓછું કરી નાંખ્યું અને તેને કારણે ઈમામી, ડાનર, હિંદુસ્તાન યુનિલીવર, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, કોલગેટ વગેરે મોટા ભાગની કંપનીઓના વેચાણો અને નફાશક્તિ ઘટીને આવ્યા છે. પરંતુ આ નબળાઈનું પુનરાવર્તન બીજા કે ત્રીજા ક્વાર્ટરમાં જોવાવાની કોઈ સંભાવના મને નથી લાગતી અને ખાસ કરીને સારા ચોખ્ખાને કારણે બીજા અને ત્રીજા ક્વાર્ટરના આંકડા જોરદાર આવશે તેવો ભાવ અંગે આ મહત્વની કોઈ સંભાવના મને નથી જોઈએ તો આવતાં ૬ મહિના દરમ્યાન અનેક એફએમસીજી શેરોમાં આપણને સુધર ઉછાળો જોવા મળશે તેવી ગણતરી છે.

આઈટીસીમાં નાના કરેક્શન પછી દાખલ થવાની વાત કરેલી. અત્યારે ૩.૨૮૧-૨૮૨ ઉપર ચાલી રહ્યો છે અને તેમાં ૩.૨૭૧-૨૮૧ વચ્ચેના ભાવે થોડું થોડું રોકાણ કરી શકાય.

ડાનરમાં અત્યારે નબળાઈનો તબક્કો છે. પ્રથમ ક્વાર્ટરના નબળા પરિણામ પછી ડાનર ૩.૨૮૮ ઉપર આવ્યો છે અને આવતાં થોડાં દિવસોમાં વધારે ઘટીને ૩.૨૮૦ આસપાસ આવે ત્યારે તેમાં રોકાણ શરૂ કરી શકાય.

તે જ પ્રકારે ઈમામીમાં પણ અત્યારે નબળા પરિણામ પછી ઘટાડાનો ટ્રેન્ડ શરૂ થયો છે. ૩.૧૮૦ના ભાવે આ શેરમાં આવતાં થોડાં દિવસોમાં હજી નાના ઘટાડાની જગ્યા છે. એક વખત ૩.૧૦૪-૧૦૫૦ આસપાસ આવે ત્યારે તેમાં એન્ટ્રી લઈ શકાય.

મેરીકોનો શેર પણ અત્યારે કરેક્શનના તબક્કામાં છે. અત્યારે ૩.૩૧૪ ઉપર છે અને આવતાં થોડાં દિવસોમાં મેરીકોમાં ૩.૩૦૦ સુધી કે પછી ૩.૨૮૫ સુધી ભાવ ઉતરી જાય તે શેરમાં વધારે ભડકો થાય તે સંભાવના છે.

ગોદેજી કન્સ્યુમર પણ છેલ્લાં ઘણાં દિવસોથી કરેક્શનમાં હતો. અત્યારે ૩.૮૦૪ ઉપર આવ્યો છે અને આગામી દિવસોમાં આ શેરમાં ભાવ કંઈક સ્થિર થાય અથવા વધવાનું શરૂ થાય તો રોકાણ કરી શકાય. પરંતુ ગોદેજી કન્સ્યુમરમાં નવું રોકાણ કરતાં પહેલાં ભાવ ઘટતો અટક્યો છે તે ખાસ ચેક કરી લેજો.



શકાય. હિંદાનિયાનો શેર પકડી લેવાનું એનાલિસિસની દૈનિકે સમજાવેલું. ચાણક્યના અંક નં. ૧૮માં જૈની બહેને હિંદાનિયાનો શેર ૩.૩૮૦ના ભાવે ક્વર કરવાનું દર્શાવેલું અને સાથે સાથે ૪.૪૫૦નું લક્ષ્યાંક આપ્યું હતું. અત્યારે આ તમે ૨૩મો અંક વાંચી રહ્યા છો. એટલે કે લગભગ ૪ અઠવાડિયા થયા અને શેર ૪.૪૪૪ ઉપર આવી ગયો છે. જાળવી રખાય અને અંક ૧૮માં દર્શાવેલું તે મુજબ ૪.૪૫૦નો ભાવ આવવાની ગણતરી છે.

૩. ૧૦૮૭ના ભાવે કોલગેટ પામોલિવનો શેર પણ ધ્યાનમાં રખાય. પતંજલિની દંત કાંતિ આવે કે ડાનરની લાલ દંતમંજન પરંતુ કોલગેટ એ કોલગેટ જ છે અને દેશનાં નાનાં-મોટાં ગામડાંઓમાં દૂધપેસ્ટ એટલે કોલગેટ તે બધાંને ખબર છે અને હવે જ્યારે કેન્દ્ર સરકાર સ્વચ્છતા અભિયાન ઉપર એક કમીટી રહી છે ત્યારે કોલગેટને આડકતરો ફાયદો મળે તે સંભાવના છે. આગામી દિવસોમાં ૩.૧૦૮૭ના ભાવે આ શેર ઝડપથી ૩.૧૧૮૮ થયે થયે તે સંભાવના મજબૂત છે અને તેથી રોકાણ જાળવી રખાય.

તે જ પ્રકારે પ્રોક્ટર એન્ડ ગેમ્બલનો ૩.૮૧૧૮ ઉપરનો શેર પણ ક્વર કરી શકાય. પ્રોક્ટરનો શેર અત્યારે લગભગ ૫૮ના પીઈ રેશિયો ઉપર ચાલી રહ્યો છે અને તેથી દેખીતી રીતે તો મોંઘો છે જ. તેમ છતાં જૂનું રોકાણ હોય તો જાળવી રખાય. આવા ઉંચા ભાવે નવો શેર લેવો હોય તો કોલગેટ કે હિંદુસ્તાન યુનિલીવર લેવો વધારે સારો.

આઈટીસીમાં નાના કરેક્શન પછી દાખલ થવાની વાત કરેલી. અત્યારે ૩.૨૮૧-૨૮૨ ઉપર ચાલી રહ્યો છે અને તેમાં ૩.૨૭૧-૨૮૧ વચ્ચેના ભાવે થોડું થોડું રોકાણ કરી શકાય.

ડાનરમાં અત્યારે નબળાઈનો તબક્કો છે. પ્રથમ ક્વાર્ટરના નબળા પરિણામ પછી ડાનર ૩.૨૮૮ ઉપર આવ્યો છે અને આવતાં થોડાં દિવસોમાં વધારે ઘટીને ૩.૨૮૦ આસપાસ આવે ત્યારે તેમાં રોકાણ શરૂ કરી શકાય.

તે જ પ્રકારે ઈમામીમાં પણ અત્યારે નબળા પરિણામ પછી ઘટાડાનો ટ્રેન્ડ શરૂ થયો છે. ૩.૧૮૦ના ભાવે આ શેરમાં આવતાં થોડાં દિવસોમાં હજી નાના ઘટાડાની જગ્યા છે. એક વખત ૩.૧૦૪-૧૦૫૦ આસપાસ આવે ત્યારે તેમાં એન્ટ્રી લઈ શકાય.

મેરીકોનો શેર પણ અત્યારે કરેક્શનના તબક્કામાં છે. અત્યારે ૩.૩૧૪ ઉપર છે અને આવતાં થોડાં દિવસોમાં મેરીકોમાં ૩.૩૦૦ સુધી કે પછી ૩.૨૮૫ સુધી ભાવ ઉતરી જાય તે શેરમાં વધારે ભડકો થાય તે સંભાવના છે.

ગોદેજી કન્સ્યુમર પણ છેલ્લાં ઘણાં દિવસોથી કરેક્શનમાં હતો. અત્યારે ૩.૮૦૪ ઉપર આવ્યો છે અને આગામી દિવસોમાં આ શેરમાં ભાવ કંઈક સ્થિર થાય અથવા વધવાનું શરૂ થાય તો રોકાણ કરી શકાય. પરંતુ ગોદેજી કન્સ્યુમરમાં નવું રોકાણ કરતાં પહેલાં ભાવ ઘટતો અટક્યો છે તે ખાસ ચેક કરી લેજો.

આત્યારે ઘટીને ૩.૮૦૪ ઉપર આવી ગયેલા યુનાઈટેડ લુગરીના શેરમાં હજી વધારે તીવ્ર ઘટાડાની જગ્યા છે અને તેથી અત્યારના તબક્કા નવા રોકાણથી દૂર જ રહેવું સલાહભરેલ છે.

જિલેટનો શેર અત્યારે ૩.૫૩૮ ઉપર આવી ગયો અને તે રીતે ભાવન અઠવાડિયાના ટોપની નજીક શેર ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં જિલેટમાં પણ મજબૂત ઉછાળાની જગ્યા દેખાય છે અને આ શેર ધીરે ધીરે વધીને ૩.૫૪૫નું લેવલ બતાવે તે સંભાવના મજબૂત છે.

આસપાસ આવે ત્યારે તેમાં રોકાણની તૈયારી રાખવી. કયા લિમિટેડના શેરમાં કોઈ જ આકર્ષણ નથી. સતત નુકસાને કારણે મેરીકોએ તો આ બિઝનેસને અલગ કંપનીમાં મૂકી દીધેલો. પરંતુ અલગ કંપનીમાં ગયા પછી પણ નુકસાનમાં કોઈ ફેરફાર નથી થયો અને અત્યારના ૩.૮૨૦ના ભાવે આ શેર ક્યાં સુધી આવું પોઈ વેલ્યુએશન જાળવી રાખશે તે એક પ્રશ્ન છે. બીજાને શેર રાખવા હોય તો રાખવા દો. પરંતુ તમે આ શેરમાંથી નીકળી જશો તો વધારે ફાયદાકારક રહેશે.

આ ઉદ્યોગના અન્ય શેરોમાં અત્યારે કોઈ જ આકર્ષણ નથી દેખાતું અને મેકલિઓર્ક રસેલના નફાની સરખામણીમાં તેનો અત્યારનો બજારભાવ અતિશય ઉંચા લેવલ ઉપર હોવાથી તેમાં રોકાણની સલાહ નથી.

પેઈન્ટ કંપનીઓને અનેક એનાલિસ્ટો હવે એફએમસીજી કંપની તરીકે ગણે છે. કારણ કે આ કંપનીઓમાં વેચાણો પણ તેની બ્રાંડને આધારે વધારે હોય છે અને તે દૈનિકોપ્રથી જોઈએ તો અત્યારના ૩.૧૧૩૫ના ભાવે એશિયન પેઈન્ટનો શેરમાં શોર્ટટર્મ ટ્રેન્ડ નબળો છે. એશિયન પેઈન્ટમાં પણ જૂન ક્વાર્ટરના આંકડા નબળા આવાયા પછી ભાવમાં ઘટાડાનો દોર જોવાયો અને હજી થોડી નબળાઈ ચાલુ રહે તે ભય છે. શેર એક વખત ૩.૧૧૦૦ની અંદર આવે ત્યારે તેમાં થોડું રોકાણ કરી શકાય.

અત્યારના ૩.૧૮૦ના ભાવે એકોનોમીકલનો શેર ક્વર કરી શકાય અને કમાણીની સરખામણીમાં આ શેર અત્યારે ઘણા જ આકર્ષક વેલ્યુએશન ઉપર મળી રહ્યો છે અને આગામી દિવસોમાં તેમાં મજબૂત રિટર્ન જોવા મળે તેવી ગણતરી છે.

જૂન ક્વાર્ટર દરમ્યાન મોટા ભાગની ટાયર કંપનીઓના આંકડા નબળા આવાયા છે. પરંતુ હવે ઓટોમોબાઈલના વેચાણો જોરદાર ચાલુ થઈ ગયા હોવાથી અને સાથે સાથે ફૂડ અને કાર્બન બ્લેન્ડના ભાવ પણ નીચા હોવાથી ટાયર કંપનીઓ માટે સારો સમય છે.

એવેલો ટાયરનો શેર અત્યાર